

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૮/૨૦૧૭ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૯૧૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૧ વ્યક્તિઓને ઝડપી, ૮૧ લીટર દેશી દારૂ, ૪૧૯ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧૦૮ ક્વોટર ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૧૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૯૧૩/૧૭

નરોડા : વિમળાબેન અમૃતભાઈ પરમાર (ઉ.વ.૪૯)(રહે,ગોપીનાથ સોસાયટી, એસ.ટી.વર્કશોપની બાજુમા નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૮/૧૭ નાં કલાક ૩/૩૦ વાગ્યાનાં સુમારે નરોડા પાટીયા પાસે આવેલ ઇકરા સ્કુલ નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક અજાણ્યો પુરૂષ સામેથી ચાલતો આવી, વિમળાબેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એચ.જાડેજા ચલાવે છે.

ઓઢવ : રેખાબેન વા/ઓ બદ્રિપ્રસાદ સાંખલા(ખટીક) (રહે,મારૂતિધામ સોસાયટી, ગીતા-ગૌરી સિનેમા પાછળ, ખારીકટ કેનાલ પાસે, ઓઢવ) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૮/૧૭ રાતનાં ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે પોતલા ઘર આગળથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરના) રેખાબેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટ : જોસેફ સાયમન સિલ્વસ્ટર (ઉ.વ.૫૦)(રહે.ભગવતી એપાર્ટમેન્ટ જવાહરનગર સરદારનગર) એ પોતાની ખેંચની બીમારીથી કંટાળી જઈ તાર૦/૦૯/૨૦૧૭ સાંજના ૪/૪૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે ઇન્દીરાબ્રીજ નીચે સાબરમતી નદીના પટ નજીક નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

શહેરકોટડા : મિતલબેન દિપકકુમાર પંચાલ (ઉ.વ.૩૧)(રહે,સલમ પોળના નાકે, મીઠા પાણીના દરવાજા પાસે સરસપુર) એ કોઈ અગમ્ય કારણોસર તાર૦/૦૯/૧૭ બપોરના ૩/૧૫ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ શંકરભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.